

NALIN[®] LEASE FINANCE LIMITED

CIN: L65910GJ1990PLC014516

NLFL/2021-22/BSE2015

Date: 13th November, 2021

To,

BSE Ltd.

Phiroze Jeejeebhoy Towers 25th Floor, Dalal Street

Mumbai - 400001

Company Code 531212

<u>Subject: Publication of Unaudited Financial Results for the quarter and half year ended on</u>
<u>30th September, 2021 - reg.</u>

Dear Sir(s),

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we inform you that the Unaudited Financial Results for the quarter and half year ended on 30th September, 2021 of the Company has been published in Western Times (both English and Gujarati language newspapers) on Saturday, 13th November, 2021.

Copies of the said publication are enclosed for your reference.

Kindly take the same on record and acknowledge the receipt of the same.

Thanking you,

Yours faithfully,

For Nalin Lease Finance Limited

Nikulkumar Patel

Chief Financial Officer

Enclosure: As above

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો

દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર નહી

નવી દિલ્હી, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી

જનતા હેરાન પરેશાન છે. પરંતુ તેમના માટે એક રાહતના સમાચાર આવ્યા છે. દેશની પ્રમુખ ઈંધણ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા. નવા જાહેર થયેલા ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ગઈ કાલના એટલે કે જૂના ભાવે જ થશે. નોંધનીય છે કે દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર નિર્ભર કરે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાનો સિલસિલો સતત ચાલુ છે. આજે ફરીથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકામાં ક્રૂડ ઈનવેન્ટ્રીમાં નોંધાયેલા વધારાને કારણે ક્રૂડ ઓઈલમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે એસએમએસદ્વારા પણ જાણી શકો

ઈન્ડિયન

ઓઈલ

અમેરિકામાં કૂડ ઈનવેન્ટ્રીમાં નોંધાચેલા વધારાને

ञारश ङू	ડ આઇલમાં ર	<u> </u>	। नाधाध	રભા છ
દેશના	મોટા શહેરોય	માં પેટ્ટોલ-ક	ടിઝલના	ભાવ

<u>શહેર</u>	<u>પેટ્રોલ</u>	<u>ડીઝલ</u>
નવી દિલ્હી	१०३.૯૭	८६.६७
મુંબઈ	906.66	૯४.१४
કોલકાતા	१०४.६७	८५.७५
ચેન્નાઈ	101.80	७१.४३
ભોપાલ	૧૦૭.૨૩	60.69
હેદરાબાદ	१०८.२०	૯૪.૬૨
બેંગલુર <u>ુ</u>	१००.५८	૮૫.૦૧
લખનો	૯૫.૨૮	८६.८०

આઈઓસીતમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલમાં આરએસપીઅને તમારા શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના રેટ આવી જશે. દેરેક શહેરના કોડ અલગ અલગ હોય છે.

જે તમને જૈંઝ ની વેબસાઈટ પર જાણવા મળશે. રોજ સવારે ૬ વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીંજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.

આઉટ થતાં કીવી બેટસમેને બેટે ફેંટ મારતાં હાથમાં ઈજા

વર્લ્ડ ટી૨૦ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડે શાનદાર જીત હાંસલ કરી હતી. પણ આ મેચ બાદ ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટ્સમેન ડેવોન કોન્વે ટી૨૦ વર્લ્ડ કપેની ફાઈનલ અને આગામી ભારત પ્રવાસમાંથી બહાર ફેંકાઈ ગયો છે. મેચ દરમિયાન આઉટ થતાં ગુસ્સામાં આવીને કોન્વેએ પોતાના બેટને જોરથી ફેંટ મારી હતી. જો કે, બાદમાં હાથ ભાંગી જતાં તેને હવે ફાઈનલમાંથી બહાર થવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે રમાયેલ ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સફળતાથી ૧૬૭૨ન ચેઝ કર્યાં હતા અને તેમાં ડેવોન કોન્વેએ શાનદાર ૪૬ રનોનો ફાળો આપ્યો હતો. હવે

ફાઈનલમાંથી તે બહાર ફેંકાઈ જતાં ન્યૂઝીલેન્ડ ટીમની ચિંતામાં વધારો થયો છે. કેમ કે, રવિવારે ઓસ્ટ્રેલિયા સામે ન્યૂઝીલેન્ડ ટી૨૦ વર્લ્ડ કંપની ફાઈનલ રમનાર છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા એક નિવેદન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે, અબુધાબીમાં ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં ડેવોન કોન્વેએ આઉટ થયા બાદ પોતાના બેટને હાથ મારતાં તેને ઈજા પહોંચી છે. અને આજે કરવામાં આવેલાં એક્સ-રેમાં જાણવા મળ્યું છે કે, તેના હાથની પાંચમી આંગળીમાં ફ્રેક્ચર છે. કોન્વેની ઈજા અંગે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના હેડ કોચ ગેરી સ્ટીડે કહ્યું કે, કોન્વે બરબાદ થયો તે સમજી શકાય છે. સેમિફાઈનલમાં આ રીતે આઉટ થવાને કારણે તે ભારે નિરાશ થયો

ઉષા કપૂરે મિસિસ ઇન્ડિયા ઓડિસિચેસનો ખિતાબ જીત્થો

તા. ૯ નવેમ્બરના રોજ દિલ્હી ઇન્ટરનેશનલ કેવીન ૨૦૨૧ માં ૨૦,૦૦૦ થી વધુ ગામડાની ામાસસ ઇાન્ડયા

ઓડિસિયસનો ખિતાબ જીત્યો છે અને આ સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. ફર્સ્ટ જનરેશન ઉદ્યમી ઉષા કપૂર ખુબજ ડાયનેમિક અને પોઝિટિવ વિચાર સરણી ધરાવતી વ્યક્તિ છે. અને અપકેપ નામની સફળ કંપનીના

પ્રમોટર છે. ૨૦૦૩ માં પ્લે સ્ક્લ થી તેમને પોતાની ધંધાકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. નાના બાળકોને તેમના નાનીઉમરે સારું ઘડતર અને કેળવણી મળી રહે તે ઉદ્દેશ સાથે આ કાર્યની શરૂઆત કરી હતી. તેઓ પોતે કોસ્મેટોલોજિસ્ટ છે. બ્યટી અને

વેલનેસ સેક્ટર પણ કાર્યરત છે. તેઓ સ્કિલ ડેવલોપમેન્ટમાં પણ ખાતે યોજાયેલ બ્યુટી પેજેન્ટમાં કાર્યરત છે અને આ સાથે આયુર્વેદિક શ્રીમતી ઉષા કપરે મિંસિસ ઇન્ડિયા 🛮 પ્રોડક્ટ પણ બનાવે છે. તેઓએ

> બહનાન બ્યુટા અન વેલનેસ ક્ષેત્રમાં તાલીમ આપી આત્મનિર્ભર બનાવ્યા છે. તેમના કાર્ય ના કારણે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીએ તેમની સાથે એમઓયુ પણ સાઈન કરેલ છે. અને તેમને સખી મંડળ દ્વારા

બહેનોને સ્વનિર્ભર કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડયું છે. આ વિશે જણાવતા ઉષા કપૂર કહે છે કે, આ ખિતાબ તેઓએ દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે અને આર્થિક રીતે સ્વાવલંબી અને પગભર કરવા બહુજ કામ લાગશે.

આસપાસ રહીને તેને સપોર્ટ કરી રહ્યા

હતો. ડેવોન બ્લેકકેપ્સ તરફથી રમવા માટે અતિ ઉત્સાહી છે અને આ ક્ષણે તેના જેટલો દુઃખી માણસ અન્ય કોઈ નહીં હોય. જેથી અમે અત્યારે તેની

ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે

પહેલી ટેસ્ટ ૨૫ નવેમ્બરથી

રમાનારી બે ટેસ્ટ મેચની સિરિઝ

માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી

કાનપુરમાં અને બીજી ટેસ્ટ મુંબઈમાં

રમાવાની છે.વિરાટ કોહલીને ટી-

૨૦ સિરિઝની સાથે પહેલી ટેસ્ટ

માટે આરામ અપાયો છે ત્યારે

પહેલી ટેસ્ટ માટે રહાણેને કેપ્ટન

બનાવાયો છે જ્યારે ચેતેશ્વર પૂજારા

વાઈસ કેપ્ટન રહેશે.રોહિત શર્માને

આખી સીરિઝમાં આરામ અપાયો

છે.સાથે સાથે વિકેટકીપર ઋષભ

દેવાઈ છે.

ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

સ્ટાર્સને આરામ, ઈન્ડિયા

જુનિચર્સને મેદાનમાં ઊતારશે

સિક્યોરિટાઇડેશન એન્ડ રિકસ્ટ્કશન ઓફ કાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ (આ કાયદો) સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ (આ નિયમો) ૩(૧) સાથે

વાંચવામાં આવ્યો છે. ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩(૧૨) હેઠળ આપવામાં આવેલ સત્તાઓના ઉપયોગમાં આ નિયમોના નિયમ ૩ ની સાથે વાંચતા, આઈઆઈએકએલ ગૃહ ફાઇનાન્સ લિમિટેડ (IIFL HFL) (અગાઉ ઈન્ડિયા ઇન્ફોલાઇન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ)ના અધિકૃત અધિકારીએ જીરી કર્યા છે. ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩ (૨) હેઠળ માંગણી નોટિસ, ઉધાર

રાઇગાન્ય લામારું ગુખાવરા આવશે ત્યાં અધ્યાસ કરવા છે. ઉપરાંતના આવતા માટે લાક લ કરે છે. ઉપરાંત મોળધાની, લોનારા (ઓ) તે, તેઓને સંબંધિત દેમાન્ડ નોટિસ (ઓ)માં જણાવેલ ટક્મ પરત કરવા માટે હાકલ કરે છે. ઉપરાંત સંબંધમાં, કરીથી આ સુવત્તા પ્રકાશિત થયાની તારીખથી ૯૦ દિવસની અંદર લેણદાર(ઓ)ને ચૂકવણી કરવા માટે સૂચના આપવામાં આવે છે, ના વધુ વ્યાજ સાથે, નીચે જણાવેલ રકમ, ઓ માંગણી સૂચના ચુકવણીની તારીખ સુધી લેણદાર (ઓ) ની વિગત, તારીખ મુજબની રકમ માંગની સૂચના અને લોનની રકમની ચુકવણી માટે આપવામાં આવતી સુરક્ષા નીચે મુજબ છે:

જો આ દેવાદાર ઉપરોક્ત IIFL, HFL ને ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો IIFL, HFLઆ એક્ટની કલમ ૧૩(૪)

હેઠળ ઉપરોક્ત સિક્યોર્ડ એસેટ્સ સામે કાર્યવાહી હાથ ધરશે અને લાગુ થતા નિયમો/સમગ્રપણે તે દેવાદારના જોખમે અને ભોગે રહેશે. વધુ માહિતી માટે અધિકૂત અધિકારીશ્રીની બ્રાંચ ઓફીસ : ઓફીસ નં.૭૦૧, સાતમો માળ, 21st સેન્ચ્યુરી બિઝનેર

સેન્ટર, ઉર્ષના દરવાજા પાસે, રીંગ રોડ, સુરત-૩૯૫૦૦૨/અથવા કોર્પોરેટ ઓફિસ: પ્લોટ નં.૯૮, ઉદ્યોગ વિહાર, ફેસ-૪,

સ્થળઃ સુરત તારીખઃ ૧૩-૧૧-૨૦૨૧ સહી/- અધિકૃત અધિકારી, IIFL હોમ ફાઇનાન્સ લીમીટેડ વતી

0 9 - N o v - 2 0 2 1 Rs.10,59,809/- (રૂપિયા દસ લાખ ઓગણ સાઈઠ હજાર આઠસો નવ ફક્ત) (૩૨૭), આશરે ૬૭.૪૧ રકે.મી. સુરત, ગુજરાત-૩૯૫૦૧૦ભારત ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત

ડીમાન્ડ નોટીસ

પંત અને ફાસ્ટ બોલર જસપ્રીત

બુમરાહને પણ આરામ આપવામાં

અજિંકચ રહાણે (કેપ્ટન),કે એલ

રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર

પૂર્જારા (વાઈસ કેપ્ટન), શુભમન

ગિલ, શ્રેયસ એયર, ઋધિમાન

સહા(વિકેટ કીપર), કે એસ ભરત(વિકેટ કીપર), રવિન્દ્ર

જાડેજા, આર અશ્વિન, અક્ષર

પટેલ, જયંત યાદવ, ઈશાંત

શર્મા, ઉમેશ યાદવ, મહોમ્મદ

શમી, મહોમ્મદ સિરાજ, પ્રસિધ્ધ

ભારતની ટીમ આ પ્રમાણે છેઃ

જેસલમેર નજીક ટ્રક-કાર ટકરાતાં ત્રણનાં મોત થયા

જેસલમેર, રાજસ્થાનના જેસલમેરમાં કરી હતી.

ગઈકાલે રાત્રે થયેલા દર્દનાક રોડ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. તો અન્ય ર સદસ્યો ઘાયલ થયા છે. આ ઘટનામાં ૬ વર્ષના માસુમ બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. અકસ્માતને ભેટનાર આ

પરિવાર વડોદરાનો રહેવાસી હતો, જેઓ દિવાળી વેકેશનમાં જેસલમેર ફરવા ગયો હતો. પરિવારની કાર અને ટ્રક સાથેના જોરદાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. ગુરુવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. વડોદરાથી એક પરિવાર જેસલમેર ફરવા આવ્યો હતો. જેસલમેરથી ૩૦ કિલોમીટર પહેલા તેમની કારની ટક્કર પથ્થર ભરેલા એક ટક સાથે થઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક તાત્કાલિક સ્થળ પરથી ફરોર થઈ ગયો હતો. રસ્તા પરથી પસાર થતા અન્ય મુસાફરોએ ઘાયલોને

હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી

વડોદરાના જયદ્રથભાઈ (ઉ.વ.૫૫), આમિત્રી દેવી (ઉં.વ.૫૨), નીતિનભાઈ (ઉ.વ.૩૦), સત્યે ન્દ્રભાઈ (ઉ.વ.૩૫) તેમજ શિવમ કુમારી (ઉ.વ.૨૯) અને વિવાન (ઉ.વ.૬) અર્ટિકા કારમાં જેસલમેર ફરવા જઈ રહ્યાં હતાં. અકસ્માતમાં જયદ્રથભાઈ, આમિત્રી દેવી અને નીતિનભાઈનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ૬ વર્ષના બાળક વિવાન બચી ગયો છે.

અકસ્માતમાં ઘાયલ લોકોની મદદે રોડ પરથી પસાર થતા અન્ય લોકો આવ્યા હતા. તેમણે ઘાયલોને જવાહર હોસ્પિટલમાં ખસેડચા હતા. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે જોધપુરની હોસ્પિટલમાં રિફર કરાયા છે. ઘટનાની માહિતી મળતા જ નજીકના પોલીસ સ્ટેશનના અધિકારીઓ પહોંચ્યા હતા.

સેન્સેક્સમાં ૪૦૧, નિફ્ટીમાં ૧૨૦ પોઈન્ટનો ઊછાળો

મુંબઇ, દરમિયાન ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં સકારાત્મક અગાઉના સત્રમાં સેન્સેક્સ

ઉછળ્યો હતો. પ્રારંભિક

સોદામાં, ૩૦-શેર સૂચકાંક

૪૦૦.૮૭ પોઈન્ટ અથવા

૦.૬૭ ટકાના વધારા સાથે

૬૦,૩૨૦.૫૬ પર ટ્રેડ કરી રહ્યો હતો. એ જ રીતે,

નિફ્ટી ૧૨૦.૧૦ પોઈન્ટ

અથવા ૦.૬૭ ટકા વધીને

સેન્સેક્સમાં

મહિન્દ્રા બે ટકાથી વધુના

વધારા સાથે ટોપ ગેઇનર

હતો. તે પછી ટાટા સ્ટીલ,

સન ફાર્મા અને નેસ્લે

ઈન્ડિયાનો નંબર આવે છે.

ઓટો અને એનટીપીસીના

શેરમાં શરૂઆતના વેપાર

બીજી તરફ, બજાજ

9,663.90

પહોંચ્યો હતો.

વલણ વચ્ચે ઈન્ફોસિસ, રિલાયન્સ ૪૩૩.૧૩ પોઈન્ટ અથવા ૦.૭૨ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી ટકા ઘટીને પ૯,૯૧૯.૬૯ પર અને ટ્વિન્સમાં ઉછાળા સાથે સેન્સેક્સ નિફ્ટી ૧૪૩.૬૦ પોઈન્ટ અથવા શુક્રવારે શરૂઆતના કારોબારમાં ૦.૮૦ ટકા ઘટીને ૧૮,૦૧૭.૨૦ ૪૦૦ પોર્ઇેન્ટથી વધુ

પર હતો. શેરબજારના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા અને ગુરુવારે રૂ. ૧,૬૩૭.૪૬ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

કબજા નોટીસ (સ્થાવર મિલ્કત) માટેની નિયમ-૮(૧)

એફએલ હોમ ફાઇનાન્સ લીમીટેડ (અગાઉ જાણીતી ઈન્ડીયા ઈન્ફોલાઈન હાઉસીંગ ફાઈનાન્સ લિમીટેડ) (IIFL HFL)ના નીચે સહે રનાર અધિકૃત અધિકૃત્રી સિક્યોરીટાઇ તેશન એન્ડ રીકન્સ્ટક્શન ઓક કાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્કોર્સમેન્ટ ઓક સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક . ૧૦૦ ઓતર્ગત અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સનેટ) ફુલ્સ ૨૦૦૨ના નિયમ ૩ અને કલમ ૧૩(૧૨) અન્વય મળેલી સત્તાની રૂએ નીર શાવેલા દેવાદાર- જ્રામીનદારને સદર નોટિસ મળવાની તારીખથી ૬૦ દિવસની અંદર નોટિસમાં આપેલી અને નીચે મુજબની દર્શાવેલી રકમ ચૂકવલ માન્ટ નોટિસ પાઠવી હતી. દેવાદાર રકમ ચકવવામાં નિષ્કળ નીવડતા. દેવાદાર-જામીનદાર અને જાહેર જનતાને નોટિસ આપવામાં આવે છે કે નીરં ાહતા કરનાર આધિકારીએ કાયદાની કલમ ૧૩(૪) અને ઉપરોક્ત નિયમના નિયમ ૮ અન્વવે મળેલી સત્તાની રૂએ નીચે દર્શાલી મિલકતનો કબજ શીધો છે. આથી દેવાદાર અને જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે કોઈએ સદર મિલકત સંદર્ભે કોઈ પણ લેવડ-દેવડ કરવી નહીં જો કોઈ

ધાર લેનારાઓ ધ્યાન આપે કે, એક્ટની કલમ ૧૩ના પેટા કલમ (૮)ની જોગવાઈઓ માટે અનુસંધાને જો ઉધાર લેનાર આઇઆઇએફએ ાંચએકએલની બાકી ચુકવણીઓને ચૂકતે કરે છે, જે તમામ ખર્ચાઓ, ચાર્જિસ ખર્ચ અને અન્ય ખર્ચ સાથે, કોઈ પણ સમયે નિયત તારીખ પહેલાં વેચાણ શથવા ટ્રાન્સકર માટે, સુરક્ષિત અસ્ક્યામતો આઇઆઇએકએલ એચએકએલ દ્વારા વેચવામાં અથવા ટ્રાન્સકર કરવામાં આવશે નહીં અને સુરક્ષિત ાસ્ક્યામતોના ટ્રાન્સકર અથવા વેચાણ માટે આઇઆઇએકએલ એચએકએલ દ્વારા આગળ કોઈ પગલું લેવામાં આવશે નહીં.

THE THE THE TEXT			111 1011	
દેવાદારો/ જામીનદારોના નામો	સુરક્ષિત મિલ્કતનું વર્ણન (સ્થાવર મિલકત)	કુલ બાકી લેણાની રકમ (રૂા.)	डीभान्ड नोटीस तारीफ	લારીખ કબજાની
૧. શ્રી. મહેશ રામજીભાઇ ગોહેલ, ૨. શ્રી. દિનેશ કાનજી બાંડીયા, ૩.શ્રીમતી. લલીતાબેન રામજીબાઇ ગોહેલ, ૪. શ્રી. રામજી ડી. ગોહેલ (Prospect No.848782)	રેસીડ-સીયલ હાઉસ બાંધકામ રહે મી.પા. પપ જેનો પ્લોટ નં. ૧૩-એન ૧ રેવેન્યુ મર્વ નં. ૨૦૦/૧, ટી.પી. સ્ક્રીમ નં. ૧, ૧ - અસલી પ્લોટ નં. ૧, જેનો કાઇનલ પ્લોટ નં. ૧૪ અને ૧૫ વેરવાળની પદમાં ૧ પાટળ જોઇન્ટ મ્યુનિસિપલની હદમાં, રાજ્ય-ગુજરાત- ૩૬ ૨ ૨૬ પ, ભારત ખાતે આવેલી મિલ્કતના બધા ભાગ સહિત	અઢાર લાખ ચુમ્માલીસ હજાર નવસો ચુમ્મોતેર	२०२१	૧૧-તવે- ૨૦૨૧

વધુ માહિતી માટે અધિકૃત અધિકારીશ્રીની બ્રાંચ ઓફીસ : આનંદધામ કોમ્પ્લેક્ષ પહેલો માળ, શોપ નં.પ,૬,૭, બસ સ્ટેન્ડ રોડ. વેરાવળ-૩૬૨૨૬૫/ અથવા **કોર્પોરેટ ઓફિસ**ઃ પ્લોટ નં.૯૮, ઉદ્યોગ વિહાર, ફેસ-૪, ગુરગાંવ, હરીયાણા સંપર્ક કરવો.

સહી/- અધિકૃત અધિકારી, IIFL હોમ ફાઇનાન્સ લીમીટેડ વતી

દ્યો.૧થી૧૦માં પંજાબી

પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની સરકારે નવો આદેશ બહાર પાડ્યો છે. જે પ્રમાણે હવે રાજ્યની તમામ સ્કૂલોમાં પહેલા ધોરણથી લઈને ૧૦મા ધોરણ સુધી પંજાબી ભાષાનો વિષય ફરજિયાત કરવામાં આવ્યો છે.ચન્નીએ કહ્યુ હતુ કે, જો કોઈ સ્કૂલ આ આદેશનુ પાલન નહીં કરે અને પંજાબી વિષય નહીં ભણાવે તો તેને બે લાખ રુપિયાનો દેંડ કરવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે, રાજ્યમાં જેટલી પણ જગ્યાએ રસ્તો દર્શાવનારા તેમજ તમામ પ્રકારના બોર્ડ પર પંજાબીમાં લખવુ કરજિયાત રહેશે.ઓફિસોમાં પણ પંજાબી ભાષા ફરજિયાત કરવામાં આવી છે. પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને તેને ધ્યાનમાં રાખીને ચજ્ઞીની સરકાર એક પછી એક નિર્ણયો લઈ રહી છે.જોકે કેટલાક નિર્ણયોને લઈને સરકારે બેકફૂટ પર પણ આવવુ પડ્યુ છે.બીજી તરફ નવજોત સિંહ સિધ્ધુએ પોતાની જ પાર્ટી અને સરકાર પર હુમલા કરવાનુ પણ ચાલુ રાખ્યુ છે.

ભાષાનો વિષય ફરજિયાત

युनीक्षेस એन्टरप्राधसीज सीभीटेड CIN:L24219GJ1969PLC001588 રજી.ઓફિસઃ ૧૧, જી.આઈ.ડી.સી., વાપી, જિલ્લોઃ વલસાડ - ૩૯૬ ૧૯૫, ગુજરાત

૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨^૧ના રોજ પુરા થયેલા ત્રિમાસિક અને છ માસ ગાળા અંતેના અનઓડિટેડ નાણાંકીય પરીણામો (રૂ.લાખ**માં**)

ત્રિમાસિકના અંતે છ મહિનાના ગાળાના અંતે વર્ષના અંતે 2029 30-05-2029 30-06-2020 30-06-2029 30-06-2020 39-03-202

I						
	અનઓડીટેડ	અનઓડીટેડ	અનઓડીટેડ	અનઓડીટેડ	અનઓડીટેડ	ઓડીટેડ
કામગીરીમાંથી કુલ આવક	-	-	-	-	७०.०३	८३.२७
કર અને અસાધારણ વસ્તુઓ પહેલાંના સમયગાળા માટે ચોખ્ખો નફો / (ખોટ)	૪,૯૧૭.૫૨	४८४.३७	૨,૩૪૦.૫૪	૫,૪૦૧.૯૧	ર,૩૬૫.૭૮	२,३३७.७६
કર પછીના સમયગાળા માટેનો ચોખ્ખો નફો (ખોટ)	४,७१८.६०	૭૬૪.૫૮	૨,૩૩૯.૯૬	૫,૪૮૩.૧૮	ર,૩૬૫.૦૭	ર,૪૪૫.૧૧
આ સમયગાળા માટે કુલ વ્યાપક આવક {આ સમયગાળા માટે						
નુકો (કર પછી) અને અન્ય વ્યાપક આવક (કર બાદ)}	(૨૫,૬૪૫.૫૭)	પડ,દપડ.૧૯	૩૧,૮૧૫.૮૨	२८,००७.ह२	90,028.0q	1,16,866.96
ઇક્વિટી શેર કેપિટલ	૧,૩૯૦.૯૨	૧,૩૯૦.૯૨	૧,૩૯૦.૯૨	૧,૩૯૦.૯૨	૧,૩૯૦.૯૨	૧,૩૯૦.૯૨
શેર દીઠ કમાણી (દરેક રૂ. ૨/-)						ı
મૂળભૂત અને ડાયલ્યુટેડ (રૂ. દીઠ શેર) (વાર્ષિક નહી)	₹.9८	1.10	3.3€	9.८८	3.80	૩.પર
30મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના જણાવ્યા પ્રમાણે ત્રિમાસીક અને છ માસ ગાળા અંતેના અનઓડીટેડ નાણાંકીય પરિણામોનું સેબી રેગ્યુલેશન ૩૩ના સેબી (લિસ્ટિંગ એન્ડ ડિસ્કલોઝર રિક્વાયરમેન્ટસ)						

રેગ્યુલેશનસ, ૨૦૧૫ હેઠળ સ્ટોક એક્સચેન્જમાં કાઈલ કરવામાં આવ્યું છે, જેનું વિસ્તૃત કોર્મેટ ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૧ મુજબ ત્રિમાસીક અને છે માસ ગાળા અંતનું અનઓડીટેડ નાણાંકીય પરીણામોનું સંપૂર્ણ ફોર્મેટ કંપની વેબસાઇટ www.uelonline.com પર તેમજ સ્ટોક એક્સચેન્જ (એટલે કે બીએસઈ લીમીટેડ (બીએસઈ)ની વેબસાઈટ www.bseindia.com તેમજ નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઇન્ડિયા લિ. (એનએસઈ)ની વેબસાઈટ : www.nseindia.com પર પ્રાપ્ય છે, જયાં કંપનીના ઈક્વીટી શેરો લીસ્ટ કરવામાં આવેલ છે. **તોદા** : ઉપરના અનઓડીટેડ નાણાંકીય પરિણામોની સમીક્ષા ઑડિટ સમિતિ દ્વારા કરવામાં આવી હતી, ત્યાર બાદ ૧૨મી નવેમ્બર, ૨૦૨૧ ના રોજ યોજાયેલી બોર્ડ ઓફ ચુનીફોસ એન્ટરપ્રાઈઝ લીમીટેડ વતી રજનીકાન્ત દેવીદાસ શ્રોફ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડીન : ૦૦૧૮૦૮૧૦ ડિરેક્ટર્સની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા. સ્થળ : મુંબઇ તારીખ : ૧૨મી નવેમ્બર, ૨૦૨૧

કોરલ લેબોરેટરીઝ લિમિટેડ **કોર્પોરેટ કાર્યાલચઃ** ૩/બી, પાટણવાલા કમ્પાઉન્ડ, શ્રેયસ સિનેમાની સામે, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (પશ્ચિમ), મુંબઈ, મહારાષ્ટ્ર–૪૦૦૦૮૬

નોંધણીકૃત કાર્યાલયઃ એસ એફ–૨૦૬, સિલ્વર ઓક કોમ્પ્લેક્સ, બી.પી.સી. રોડ, વડોદરા, ગુજરાત–૩૯૦૦૨૦ ફોન : ૦૨૨–૨૫૦૦ ૫૨૪૫ | ઇમેલ : <u>cs@corallab.com</u> | વેબસાઇટ : <u>www.corallab.com</u>

CIN: L24231GJ1997PLC031669

	उ० सप्टम्पर, २०२१मा राष्ट्र पूरा येथला त्रिमासिङ्गाणा अने अघ पाषिड समयगाणा माट आडिट नहा येथला सटन्डअलान नाराहाच पारसामाना साराहा								
Г						(અ. લાખર	માં) (ઈપીએસના	આંકડા સિવાર	
			પૂર્ણ	થચેલો ત્રિમાસિક	ાળો	પૂર્ણ થયેલ	। छ. भहिना	પૂર્ણ થયેલ વષ	
Ш	કુમ	વિગતો	30.06.2021	30.05.2021	30.0€.₹0₹0	30.06.2021	30.0€.₹0₹0	31.03.202	

ı	કુમ ન.	વિગતો	३०.०८.२०२१	30.09.2021	30.0€.₹0₹0	३०.०€.२०२१	30.0€.₹0₹0	31.03.२0२१
ı	ы.		(ऑडिट नहीं थयेत)	(ઑડિટ નહીં થયેલ)	(ऑडिट नहीं थयेत)	(ઑડિટ નહીં થયેલ)	(ऑडिट नहीं थयेत)	(ઑડિટ થયેલ)
١	٩	કામગીરીમાંથી થયેલ કુલ આવક	૧૯૨૬.૭૭	૨૫૨૯.૦૮	9८3८.9४	૪૪૫૫.૮૪	४१५७.१४	१००३३.७३
	ર	અહીં જણાવેલ સમયગાળાનો ચોખ્ખો નફો/(ખોટ) (કર, અપવાદરૂપ અને/અથવા અસાધારણ ચીજો પહેલાં)	933.८४	૭૧૯.૩૬	39७.८४	૮૫૩.૨૦	८ ૯ ૧. <i>९</i> ४	૧૭૫૯.૩૭
	3	કરની ચૂકવણી પહેલાંના સમયગાળાનો ચોખ્ખો નફો/(ખોટ) (અપવાદરૂપ અને/અથવા અસાધારણ ચીજો પછી)	933.28	૭૧૯.૩૬	390.28	૮૫૩.૨૦	८ ૯ ૧.9૪	૧૭૬૧.૨૫
	8	કર ચૂકવ્યાં પછીના સમયગાળાનો ચોખ્ખો નફો/(ખોટ) (અપવાદરૂપ અને/અથવા અસાધારણ ચીજો પછી)	४४.८४	५८०. ३५	969.28	કરપ.૨૦	৩૧૮.૬૪	૧૩૫૫.૪૬
	ч	અહીં જણાવેલ સમયગાળાની કુલ સર્વગ્રાહી આવક જેમાં અહીં જણાવેલ સમયગાળા (કર ચૂકવ્યાં પછી) માટેના નફા/(ખોટ) અને અન્ય કુલ સર્વગ્રાહી આવક (કર ચૂકવ્યાં પછી)નો સમાવેશ થાય છે	–૨૦૯.૨૨	૨૨૭૦.૭૮	-364.69	૨૦૬૧.૫૬	१४२३.८२	૨૦૯૭.૨૫
١	9	ભરપાઈ થયેલી ઇક્વિટી શેર મૂડી	૩૫૭.૨૬	૩૫૭.૨૬	૩૫૭.૨૬	૩૫૭.૨૬	૩૫૭.૨૬	૩૫૭.૨૬
ı	O	અનામત મૂડી (પુનઃમૂલ્ચાંકનની અનામત મૂડી સિવાય)						93300.00
	۷	શેર દિહ.(પ્રત્યેક.રૂ ૧૦/ – નો) કમાણી (ચાલી રહેલા અને બંઘ થઈ ગયેલા સંચાલનો માટે.) –						
ı		૧. મૂળભૂતઃ	૧.૨૬	૧૬.૨૪	૫.૩૭	૧૭.૫૦	૨૦.૧૨	30.€४
		ર. ઘટાકેલઃ	0	0	0		0	0

તારીખઃ ૧૨ નવેમ્બર, ૨૦૨૧

- ૧ અહીં ઉપર સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાર્ચમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના નિયમ ૩૩ હેઠળ બીએસઈ લિમિટેડમાં જમા કરાવવામાં આવેલ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકગાળા અને એઈ વાર્ષિક સમયગાળા માટેના ઑડિટ નહીં થયેલાં વિગતવાર નાણાકીય પરિણામોનો સારાંશ આપવામાં આવ્યો છે. આ પૂર્ણ થયેલા અર્ધ વાર્ષિક સમયગાળાના ઑડિટ નહીં થયેલાં નાણાકીય પરિણામોનું સંપૂર્ણ ફોર્મેટ બીએસઈ લિમિટેડની વેબસાઈટ (www.bseindia.com) અને લિસ્ટ થયેલી એન્ટિટીની વેબસાઇટ (www.corallab.com) પર ઉપલબ્ધ છે.
- કંપનીએ ૧ એપ્રિલ, ૨૦૧૭થી શરૂ થઈ રહેલાં નાણાકીય વર્ષ માટે Ind ASને અપનાવેલ છે અને ઉપરોક્ત પરિણામો કંપનીઝ (એકાઉન્ટિંગ સ્ટાન્ડક્ર્ઝ) રૂલ, . ૨૦૧૫ના નિયમ ૩ની સાથે વંચાતી કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૩૩ દેઠળ તૈયાર કરવામાં આવેલ Ind AS અનુસાર તૈયાર કરવામાં આવેલ છે.
- ઑડિટ કમિટી દ્વારા ઉપરોક્ત નાણાકીય પરિણામોની સમીક્ષા દાથ ધરવામાં આવી દૃતી અને ૧૨ નવેમ્બર, ૨૦૨૧ના રોજ યોજાયેલી બોર્ડ ઑફ ડિરેક્ટર્સની

કોરલ લેબોરેટરીઝ લિમિટેડના

બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ માટે અને તેમના વતી સહી કરનાર/-

સુષમા કડકડે ડાયરેક્ટર અને સીએફઓ (DIN:07791735)

અટકનો ઉમેરો

મે મારૂ જુનું નામ **મુકેશ કુમાર** હતું જે બદલીને **મુકેશ કુમાર ખંડેલવાલ** કરેલ છે. સરનામું : -૨૬, અરિહંત બંગલોઝ બસંત બહાર રોડ-૧ સાઉથ બોપલ અમદાવાદ, ગુજરાત

Total Revenue (net)

Particulars

Whether results are Audited or Unaudited

Net Profit/(loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)

Net Profit/(loss) for the period before Tax (after Exceptional"and/or Extraordinary items)

Net Profit/(loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)

Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)

Reserves (Excluding Revaluation Reserve) as shown in the auditing Balance

Earnings Per share (of Rs 10/- each) (for

continuing and discontinuing operations)

(www.bseindia.com)& on Company's website (www.yuranusinfra.com)

Paid up Equity Share Capital

Sheet of the previous year

No.

નામમાં ફેરફાર

મેં મારું નામ **ઉમંગ મનોજકુમાર** માશુર થી બદલીને ઉમંગ મનોજ માશુર કર્યું છે. સરનામું : સી-૪/૧૦૩, ગોયલ ઇન્ટરસિટી, દૂરદર્શની સામે, બોડકદેવ, અમદાવાદ - ૫૪.

YURANUS INFRASTRUCTURE LIMITED CIN: L74110GJ1994PLC021352 Registered Office: 201, 2nd Floor, Maulik Arcade, Above Karnavati Pagarkha Bazar, Mansi Cross Roads, Vastrapur, Ahmedabad - 380 015, Gujarat Phone: 07926733353 E-Mail - info@yuranusinfra.com **Extract of Unaudited Financial Result (Standalone)** for the Quarter ended on 30/09/2021

Quarter

ended/

Current yea

30.09.202

Unaudited

20.00

2.32

2.32

350.00

-137.92

0.05

0.05

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchange websites

ended

31.03.2021

Audited

46.46

4.89

4.89

3.56

350.00

-137.92

0.10

0.10

લેસ્ટર્ન ટાઇસ્સ

જામીનાદારોના નામો તારીખ અને સ્ક્રમ શ્રી. અશોક કુમાર યાદવ શ્રીમતી. વંદના અશોક યાદવ (Prospect No.841965) દેસ લાખ ઓગણ સાઈઠ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

Corresponding

3 months

ended in the previous year

30.09.2020

Unaudited

4.97

2.42

2.42

1.79

0.00

350.00

-141.48

0.05

DENIS CHEM LAB LIMITED

[CIN: L24230GJ1980PLC003843] Registered Office: Block No. 457, Village: Chhatral, Tal: Kalol (N.G.) Dist: Gandhinagar – 382 729

EXTRACT OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE

			(Its.III Lakii)
Particulars	Quarter	Half Year	Quarter
	ended	ended on	ended
	on	30-09-2021	on
			30-09-2020
	(Unaudited)	(Unaudited)	(Unaudited)
Total income from operations (Net)	3,176.07	6,491.82	2,771.91
Net Profit for the period (before			
Tax, Exceptional and/or			
Extraordinary items)	340.96	565.79	93.43
Net Profit for the period before			
tax (after Exceptional and/or			
Extraordinary items)	340.96	565.79	93.43
Net Profit for the period after			
tax (after Exceptional and/or			
Extraordinary items)	250.56	411.77	12.76
Total Comprehensive			
Income for the period	254.25	415.46	12.76
Equity Share Capital	1387.67	1387.67	1387.67
Reserves (excluding			
Revaluation Reserve) as shown			
in the Audited Balance Sheet			
of the previous year		-	
Earnings Per Share (after			
extraordinary items) (Face value			
of Rs. 10/- each) (for continuing			
and discontinued operations)			
Basic & Diluted:	1.81	2.97	0.09

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015.
- The full format of Quarterly Financial Results is available also on the website of the Company

For DENIS CHEM LAB LIMITED HIMANSHU C. PATEL



Place: Himmatnagar

Date : 12.11.2021

NALIN LEASE FINANCE LIMITED

CIN: L65910GJ1990PLC014516 Regd.Off: Ground Floor, Gandhi Nursing Home Bldg., Dr.Nalinkant Gandhi Road, Himatnagar- 383 001. Gujarat India Phone: 02772-241264, 242264, email: info@nalinfin.co.in, www.nalinfin.co.in

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.09.2021

SI. No.	PARTICULARS	ı	For the quarter ended			
		30 Sept.2021	30 June 2021	30 Sept.2020	31 March 2021	
		Unaudited	Unaudited	Unaudited	Audited	
1.	Total Income From Operations	154.29	115.36	119.93	489.37	
2.	Net Profit/(loss) for the period					
	(before Tax, Exceptional and/or					
	Extraordinary items)	104.92	68.43	115.70	330.86	
3.	Net Profit/(loss) for the period before					
	Tax (after Exceptional and/or					
	Extraordinary items)	104.92	68.43	115.70	330.86	
4.	Net Profit/(loss) for the period after					
	Tax (after Exceptional and/or					
	Extraordinary items)	78.24	49.61	84.45	252.43	
5.	Total Comprehensive Income for					
	the period (Comprising Profit /(Loss)					
	for the period (after Tax) and Other					
	Comprehensive Income (after tax)	78.24	49.61	84.45	252.43	
6.	Paid up Equity Share Capital	655.82	655.82	655.82	655.82	
8.	Earnings Per share (of Rs 10/- each)					
	(for continuing and					
	discontinuing operations)-					
	1. Basic:	1.19	0.76	1.29	3.85	
	2. Diluted:	1.19	0.76	1.29	3.85	

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Reguirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the BSE website (www.bseindia.com) &

For, NALIN LEASE FINANCE LTD Sd/- (D.N.Gandhi) Managing Director

Place : Ahmedabad. Date : 12-11-2021

Basic

Diluted

For, Yuranus infrastructure Ltd. sd/- Mohit Desai - Director DIN: 03089420

QUARTER ENDED ON 30TH SEPTEMBER, 2021

			(
Particulars	Quarter	Half Year	Quarter
	ended	ended on	ended
	on	30-09-2021	on
			30-09-2020
	(Unaudited)	(Unaudited)	(Unaudited)
Total income from operations (Net)	3,176.07	6,491.82	2,771.91
Net Profit for the period (before			
Tax, Exceptional and/or			
Extraordinary items)	340.96	565.79	93.43
Net Profit for the period before			
tax (after Exceptional and/or			
Extraordinary items)	340.96	565.79	93.43
Net Profit for the period after			
tax (after Exceptional and/or			
Extraordinary items)	250.56	411.77	12.76
Total Comprehensive			
Income for the period	254.25	415.46	12.76
Equity Share Capital	1387.67	1387.67	1387.67
Reserves (excluding			
Revaluation Reserve) as shown			
in the Audited Balance Sheet			
of the previous year		-	
Earnings Per Share (after			
extraordinary items) (Face value			
of Rs. 10/- each) (for continuing			
and discontinued operations)			
Basic & Diluted:	1.81	2.97	0.09
Notes:-			

Place: Ahmedabad

on the website of BSE Limited at www.bseindia.com and

Date : 12th November 2021 MANAGING DIRECTOR Din No.: 00087114

7 states meet Q2 capex target, get permission to mobilise additional Rs 16,691 cr

Seven Chhattisgarh, Kerala, Madhya Pradesh, Meghalaya, Punjab, Rajasthan and Telangana -have achieved the target set by the Ministry of Finance for the capital expenditure upto 2nd Quarter of 2021-22. As an incentive, these states have been granted permission by the Department of Expenditure on Friday to borrow an additional

The additional open market borrowing permission issued is equivalent to 0.5 per cent of Gross State Domestic Product (GSDP). Additional financial re-

amount of Rs 16,691 crore.

New Delhi, sources thus made available will help the states in pushing their capital expenditure further. Capital expenditure has a high multiplier effect, enhances the future productive capacity of the economy, and results in a higher rate of economic growth. Accordingly, out of the net borrowing ceiling (NBC) of 4 per cent of GSDP for the states for 2021-22, borrowings upto 0.50 per cent of GSDP were earmarked for incremental capital expenditure to be incurred by the states dur-ing 2021-22. The target for incremental capital expenditure for each state to qualify for this incremental

borrowing was fixed by the Department of Expenditure.

To become eligible for incremental borrowing, states were required to achieve at least 15 per cent of the target set for 2021-22 by the end of 1st quarter of 2021-22, 45 per cent by the end of 2nd quarter, 70 per cent by the end of 3rd quarter and 100 per cent by March 31, 2022. Earlier, after the first round of review undertaken in September 2021, additional borrowing permission of Rs 15,721 crore were issued to 11 states for meeting the target for capital expenditure set for the 1st quarter of 2021-

Go Fashions IPO to open for bidding during Nov. 17-22

promoter and existing

shareholders, the draft red

herring prospectus (DRHP)

ilyTrust and VKS FamilyTrust are going to offload 7.45

lakh equity shares each, Se-

quoia Capital India Invest-

Under the OFS, PKS Fam-

Ahmedabad, 12,878,389 equity shares by

The Rs 800-crore initial share-sale of Go Fashion (India) Ltd, which owns women's wear brand Go Colors, will open for public subscription on November 17.The initial public offering (IPO) will conclude on November 22, according to the red herring prospectus (RHP).

The initial public offering (IPO) will conclude on November 22, according to the red herring prospectus

(RHP) The IPO comprises fresh issue of equity shares aggregating up to ?125 crore and an offer-for-sale of up to

CHANGE OF NAME

I have changed my old name

from HAROON RAMZAN to

new name **HAROON**

RAMZAN MISTRY Add · 8 Nusrat Park B/h Torrent Power.

Vejalpur,Ahmedabad

CHANGE OF NAME I Have Changed My Old

Name From KHATRI ALIAS **SONEJI PARESH**

SHANTILAL to NEW NAME SONEJI PARESH **SHANTILAL. Add:** 75/899.

Karnavati Appartment Part-1 Sola Road, Naranpura, Ahmedabad-380063.

CHANGE OF NAME have change of my old name NAYAK PIYUSHKUMAR HARSHADBHAI TO NEW NAME NAYAK PIYUSH HARSHADKUMAR

KALYANPURA, AT.Kalol,

WESTERN RAILWAY CORRIGENDUM TO e-AUCTION

SALE PROGRAMME MATERIAL

MANAGEMENT DEPARTMENT

E-Auction Sale Programme

scheduled to be held in the month

of November-2021 at Vadodara

Division scheduled on 17.11.2021 has been rescheduled on 22.11.2021. All other terms and

conditions will remain unchanged

Please visit Western Railway

Website of material

Management Department i.e

www.wr.indianrailways.gov.in as

well as on www.ireps.gov.in e-auction portal for further information. (S III/Auction Programme-4/Nov-2021 Dt

WESTERN RAILWAY VARIOUS WORKS OF KV AC OHE Sr. Division Electric Engineer(TRD

/alsad, invites E-Tender as per detail

iven as follows: Tender Notice No. 8

Date: EL-TRD-W-118-21-22-160-2 dated.: 11.11.2021, Name of work

Design, Supply, Erection, Testing &

between Virar-Surat section o Mumbai Division of Western Railway n connection with raising of train

speed to 160 KMPH Work (Phase-II) . \dvertised Value : ₹ 97,55,12,909/

Earnest Money: Nil. Date & Time o submission : 16.12.2021, 15.00 hrs Date & Time of opening : 16.12.2021

15.30 hrs. Regarding detailed nature of

vork, containing cost of tender docume

non refundable). FMD eligibility criteria

imilar nature of work, detailed tende

onditions, please visit www.ireps.gov.ii

nanual offers will not be considered. 054

Like us on : 🚹 facebook.com/WesternRly

ommissioning of 2 x 25 KV AC OHE

For Principal Chief Materials Manager

2669

showed.

ments will sell up to 74.98 lakh shares, India Advantage Fund S4 I will divest up to 33.11 lakh shares and Dynamic India Fund S4 US I will sell up to 5.76 lakh shares. Currently, PKS Family and VKS Family Trust hold 28.74 per cent stake each in the company, Sequoia Capital holds 28.73 per cent stake, India Advantage Fund has 12.69 per cent stake and Dynamic India Fund owns 1.1

per cent stake in the firm. According to market sources, the IPO is expected to fetch Rs. 800 crore. Proceeds from the fresh issue will be used to fund the roll out of 120 new exclusive brand outlets. to support working capital requirements and general corporate purposes. The company is engaged in the development, design, sourcing, marketing and retailing of a range of women's bottom-wear products under the brand, 'Go Colors'. It is among the few apparel companies in India to have identified the market opportunity in women's bottom-wear and have acted as a 'cat-

egory creator' for bot-

tom-wear.

Notice is hereby given to public at large that Property being Office no. 707, admeasuring 722 Sq. Feet i.e. 67.14 Sq. Mtrs (Super Builtup area) on the Seventh Floor, along with undivided share in the land admeasuring 22.07 Sq.Mtrs, in a building known as "SAFAL PRELUDE" Vejalpur, Ahmedabad, Constructed on Draft T.P. Scheme No. 25 (Vejalpur) and Final Plot No. 34/2 (Old Survey No. 922/2 admeasuring about 2327 Sq. mtrs) admeasuring about 1178 Sq. mtrs. And Final Plot No. 34/1/2 (Survey No. 787 paiki and Survey No. 797/4 admeasuring about 2428 Sq. mtrs admeasuring about 708 Sq.mtrs) admeasuring about 2481 Sq. mtrs., and total admeasuring about 3659 Sq. mtrs. of Mouje Vejalpur, Taluka Vejalpur in the Registration District, Ahmedabad and Sub District, Ahmedabad -10 (Vejalpur) is presently owned and possessed by Jyoti Amit Patel.

It is stated that following documents of above mentioned property i.e. Original reg deed of Conveyance under Serial No-6952 of 2010 along with its RR and Original Mortgage deed & Release deed along with its RR has been misplaced & not traceable.

In case anybody has any prior charge, lien or an interest of any nature in respect of the said property should informed about such charge, lien, or interest with sufficient documentary evidence to the below mention address within 7 days from the date of this notice, failing to which it will be constructed that titles of the said property in favour of Present owner Jyoti Amit Patel is absolute clear, marketable and no party has any lien charge, interest or any claim of whatsoever nature on the said Property.

Date: -13/11/2021

Devang H. Dave, Advocate Office: 115, Ground Floor, Someshwar-II Complex, Opp. Star Bazaar, Satellite, Ahmedabad-380015. (M) 9375809431

Jignesh B. Patel, Advocate

VODAFONE IDEA LIMITED

Regd. Office: Suman Tower, Plot No. 18, Sector-11, Gandhinagar - 382 011, Gujarat CIN: L32100GJ1996PLC030976 Tel: +91-79-66714000 Fax: +91-79-23232251 Email: shs@vodafoneidea.com Website: www.vodafoneidea.com

Place:-Ahmedabad

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND SIX MONTHS ENDED 30-SEP-2021

(₹ Mn, except per share data)

Particulars	Quarter ended	Six month ended	Quarter ended	Year ended
Faiticulais	30-Sep-21 Unaudited	30-Sep-21 Unaudited	30-Sep-20 Unaudited	31-Mar-21 Audited
Revenue from Operations	94,064	185,587	107,912	419,522
Profit/(Loss) before Tax and Exceptional items	(71,418)	(146,383)	(64,514)	(242,853)
Profit/(Loss) before Tax and after Exceptional items	(71,283)	(144,469)	(72,185)	(442,534)
Profit/(Loss) after Tax and Exceptional items	(71,323)	(144,514)	(72,182)	(442,331)
Total Comprehensive Income / (Loss)	(71,446)	(144,575)	(72,034)	(441,963)
Paid up Equity Share Capital (Face value ₹10 per share)	287,354	287,354	287,354	287,354
Reserves excluding Revaluation Reserve	(814,209)	(814,209)	(554,352)	(669,634)
Securities Premium Account	1,084,698	1,084,698	1,084,698	1,084,698
Net worth	(526,855)	(526,855)	(266,998)	(382,280)
Outstanding Debt	1,858,637	1,858,637	1,159,415	1,803,103
Debt Equity Ratio	(3.53)	(3.53)	(4.34)	(4.72)
Earnings Per Share for the period (₹)				
- Basic	(2.48)	(5.03)	(2.51)	(15.40)
- Diluted	(2.48)	(5.03)	(2.51)	(15.40)
Debenture Redemption Reserve	4,408	4,408	4,408	4,408
Debt Service Coverage Ratio	0.37	0.36	0.29	0.45
Interest Service Coverage Ratio	0.42	0.39	0.51	0.57

- 1. The above unaudited consolidated financial results, as reviewed by the Audit Committee, were approved and taken on record by the Board of Directors at their meeting held on 12th November, 2021.
- 2. Key numbers of Standalone Financial Results :-

(₹ Mn)

Particulars	Quarter ended	Six month ended	Quarter ended	Year ended
raticulais	30-Sep-21	30-Sep-21	30-Sep-20	31-Mar-21
	Unaudited	Unaudited	Unaudited	Audited
Revenue from Operations Loss before Tax and Exceptional items Loss before Tax and after Exceptional items Loss after Tax and Exceptional items	93,215	184,097	107,235	416,727
	(71,852)	(146,522)	(64,473)	(242,109)
	(71,717)	(145,874)	(72,156)	(463,145)
	(71,717)	(145,874)	(72,156)	(462,937)

- The above is an extract of the detailed format of unaudited financial results filed with the Stock Exchanges under Regulation 33 and 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of unaudited financial results are available on the Stock Exchange websites, www.nseindia.com and www.bseindia.com and on the Company's website www.vodafoneidea.com.
- For the other line items referred in Regulation 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, pertinent disclosures have been made to the Stock Exchanges and are available on the Stock Exchange websites, www.nseindia.com and www.bseindia.com and on the Company's website www.vodafoneidea.com.

For and on behalf of the Board of Directors of **VODAFONE IDEA LIMITED**

Sd/-**Ravinder Takkar**

Managing Director & Chief Executive Officer

Place: Mumbai

Date: 12th November, 2021

CORAL LABORATORIES LIMITED

Corp Office: 3/B Patanwala Compound, Opp. Shreyas Cinema, L.B.S. Marg, Ghatkopar (W), Mumbai, Maharashtra – 400 086. Registered Office: SF-206, Silver Oak Complex, B.P. C. Road, Vadodara, Gujarat - 390020 Tel: 022-2500 5245 | Email: cs@corallab.com | Website: www.corallab.com

CIN: L24231GJ1997PLC031669 Extract of Unaudited Standalone Financial Results for the Quarter and Half Year Ended 30th September, 2021

		(Rs. in Lacs) (Except F	igures in EPS
	Quarter Ended	Half Year Ended	Year Ended

	(
Sr	Particulars	Quarter Ended			Half Year Ended		Year Ended
No		30.09.2021	30.06.2021	30.09.2020	30.09.2021	30.09.2020	31.03.2021
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Income from Operations	1926.77	2529.08	1838.14	4455.84	4167.14	10033.73
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	133.84	719.36	317.84	853.20	891.64	1759.37
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	133.84	719.36	317.84	853.20	891.64	1761.25
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	44.84	580.36	191.84	625.20	718.64	1355.46
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-209.22	2270.78	-395.91	2061.56	1423.92	2097.25
6	Paid up Equity Share Capital	357.26	357.26	357.26	357.26	357.26	357.26
7	Reserves (excluding Revaluation Reserve)						13307.07
8	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations)						
	1. Basic:	1.26	16.24	5.37	17.50	20.12	37.94
	2. Diluted:	0	0	0		0	0

- a) The above is an extract of the detailed Unaudited Financial Results for the Quarter and Half Year Ended, September 30, 2021 filed with the BSE Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Half Year Ended Unaudited Financial Results are available on the website of the BSE limited (www.bseindia.com) and the listed entity (www.corallab.com).
- b) The Company has adopted Ind AS for the financial year commencing from 1st April, 2017 and above results have been prepared in accordance with Ind AS, as prepared under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Accounting Standards) Rule, 2015.
- c) The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on November 12, 2021.

For and on behalf of the Board of Directors of **Coral Laboratories Limited**

> Sushma Kadkade Director & CFO (DIN:07791735)

NALIN LEASE FINANCE LIMITED CIN: L65910GJ1990PLC014516

Regd.Off: Ground Floor, Gandhi Nursing Home Bldg., Dr.Nalinkant Gandhi Road, Himatnagar- 383 001. Gujarat India Phone: 02772-241264, 242264, email: info@nalinfin.co.in, www.nalinfin.co.in

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL

	RESULTS FOR THE C	UARTER EN	DED ON 30.09	.2021	(Rs.in Lacs
SI. No.	PARTICULARS	ı	For the year ended		
		30 Sept.2021	30 June 2021	30 Sept.2020	31 March 2021
		Unaudited	Unaudited	Unaudited	Audited
1.	Total Income From Operations	154.29	115.36	119.93	489.37
2.	Net Profit/(loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	104.92	68.43	115.70	330.86
3.	Net Profit/(loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	104.92	68.43	115.70	330.86
4.	Net Profit/(loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	78.24	49.61	84.45	252.43
5.	Total Comprehensive Income for the period (Comprising Profit /(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)	78.24	49.61	84.45	252.43
6.	Paid up Equity Share Capital	655.82	655.82	655.82	655.82
8.	Earnings Per share (of Rs 10/- each) (for continuing and discontinuing operations)-				
	1. Basic:	1.19	0.76	1.29	3.85
	2. Diluted:	1.19	0.76	1.29	3.85

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the BSE website (www.bseindia.com) 8 Company's website (www.nalinfin.co.in)

Place: Himmatnagar

For, NALIN LEASE FINANCE LTD Sd/- (D.N.Gandhi)

YURANUS INFRASTRUCTURE LIMITED

CIN: L74110GJ1994PLC021352

Registered Office: 201, 2nd Floor, Maulik Arcade, Above Karnavati Pagarkha Bazar, Mansi Cross Roads, Vastrapur, Ahmedabad - 380 015, Gujarat bne: 07926733353 **E-Mail** - info@yuranusinfra.com **Extract of Unaudited Financial Result (Standalone)**

	for the Quarter ended	21	(Rs.Lacs)		
Sr No.	Particulars	Quarter ended/ Current year ending 30.09.2021	Year ended 31.03.2021	Corresponding 3 months ended in the previous year 30.09.2020	
	Whether results are Audited or Unaudited	Unaudited	Audited	Unaudited	
1	Total Revenue (net)	20.00	46.46	4.97	
2	Net Profit/(loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	2.32	4.89	2.42	
3	Net Profit/(loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	2.32	4.89	2.42	
4	Net Profit/(loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	1.74	3.56	1.79	
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)	0.00	0.00	0.00	
6	Paid up Equity Share Capital	350.00	350.00	350.00	
7	Reserves (Excluding Revaluation Reserve) as shown in the auditing Balance Sheet of the previous year	-137.92	-137.92	-141.48	
8	Earnings Per share (of Rs 10/- each) (for continuing and discontinuing operations)-				
	Basic:	0.05	0.10	0.05	
	Diluted :	0.05	0.10	0.05	

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com)& on Company's website (www.yuranusinfra.com)

Place: Ahmedabad. Date : 12-11-2021

For, Yuranus infrastructure Ltd. sd/- Mohit Desai - Director

DIN: 03089420

L&T Finance Limited Registered Office: Technopolis, 7th Floor, Plot No. 4 Block BP, Sector V, Salt Lake, Kolkata 700 091 CIN No.: U65910WB1993FLC060810 Branch office: Rajkot



PUBLIC AUCTION FOR SALE OF MORTGAGED PROPERTY

The Authorised Officer of L&T Finance Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 [54 OF 2002] and in exercise of powers conferred under the said Act is auctioning the following property on "AS IS WHERE IS BASIS" and "AS IS WHAT IS CONDITION" by way of "PUBLIC AUCTION" for recovery of its dues and further interest, charges and costs etc

Name of Original Borrower	Secured Property Address	Loan Account Number(s)	Physical Possession taken	Earnest Money Deposit 10% or more of RP (In ₹)	Total Outstanding dues as on 04/10/2021 (in ₹)	Reserve Price (In ₹)	Date of Inspection	Date and Time of Auction
1. Ranjit Dikhit 2. Jyotisingh Ranjitsingh Dikhit 3. Balaji IT group	All That Part And Parcel Of The Immovable Property Situated At Yagnik Road, City Survey Ward No. 14, Sheet No. 131, City Survey No. 124-A Paiki, Land Admeasuring Area 510.87 Sq. Yard, Building Thereon Known As Madhav Complex, Paiki First Floor, Office No. 105, Carpet Area, 16.62 Mtrs., Rajkot.	RJKHL1800 0337	18/10/2021	Rs. 2,01,184/-	Rs. 23,84,486.46/-	Rs. 20,11,838/-	06th December 2021 11:00 AM to 02:00 PM	10th December 2021 and 11:00 AM to 02:00 PM

- 1. The Auction Sale is being conducted by the Authorised Officer under the provisions of SARFAESI Act with the aid and through public auction mode 2. The public auction will be conducted on the date and time mentioned herein above, when the secured asset mentioned above will be sold on "AS IS WHERE IS" BASIS & "AS IS WHAT IT IS" CONDITION.
- 3. For participating in the public auction, intending purchasers/bidders will have to submit the details of payment of refundable Earnest Money Deposit of $10\,\% of the reserve price of the secured assets along with copies of the PANCARD, Board Resolutions in case of company and Address Proof on or before$ 08.11.2021.
- $4. \quad The EMD of all other bidders who did not succeed in the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction. The EMD of all other bidders who did not succeed in the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction. The EMD of all other bidders who did not succeed in the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction. The EMD of all other bidders who did not succeed in the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction. The EMD of all other bidders who did not succeed in the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction. The EMD of the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction. The EMD of the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction will be refunded by LTF within 7 days of the closure of the public auction 8 days of the closure of the public auction 8 days of the closure of the public auction 8 days of the closure of the public auction 8 days of the closure of the public auction 8 days of the closure of the public auction 8 days of the closure of the public auction 8 days of the closure of the public auction 8 days of the closure of the public auction 8 days of the closure of the public auction 8 days of the closure of the public auction 8 days of the closure of the public auction 8 days of$ will not carry any interest.
- 5. The successful purchaser/bidder shall deposit the 25 % (inclusive of EMD) of his/its offer by way of by way of D.D./P. O favoring "L&T Finance Limited" payable at Rajkot on or before 18:00 hours on 10.11.2021 i.e., day of auction or on the next working day i.e., 11.11.2021, which deposit will have to confirmed by L&T Finance Limited, failing which the sale will be deemed have been failed and the EMD of the said successful bidder shall be forfeited. The balance amount i.e., 75% of purchase price payable shall be paid by the purchaser to L&T Finance Limited on or before the fifteenth day of $confirmation \, of \, sale \, of \, immovable \, property \, or \, such \, extended \, period \, as \, per \, provisions \, of \, law.$
- 6. For inspection of property or more information, the prospective bidders may contact the authorised officer i.e., Mr. Bharat Prajapati, Contact No-9879002844, Address - L&T Finance Limited, 2nd Floor, Office No. 212, 214 to 215, Part B, Nath Edifice, Dr. Yagnik, Road, Race Course Road, Rajkot -360001. At any stage of the auction, the Authorised Officer may accept/reject/modify/cancel the bid/offer or post-pone the auction without assigning any reason thereof and without any prior notice.
- 7. The successful purchaser/bidder shall bear any statutory dues, taxes, fees payable, stamp duty, registration fees, etc. that is required to be paid in order to get the property conveyed/delivered in his/her/its favour as per the applicable law.
- 8. The Borrower/Guarantors, who are liable for the said outstanding dues, shall treat this Sale Notice as a notice under Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, about the holding of above-mentioned public auction sale.
- 9. Erstwhile, L&T Housing Finance Ltd has been Merged with L&T Finance Ltd ('LTF') under the Scheme of Amalgamation by way of merger by absorption approved by the NCLT Mumbai as well as NCLT Kolkata, w.e.f. 12th April, 2021
- Authorized Officer

Ahmedabad, Page 7

Place: Mumbai Date: November 12, 2021